

ત્વરિત જાહેરાત માટે

જ્યારે ફરી ખોલવાની મંજૂરી મળે ત્યારે સિટી ઓફ બ્રેમ્પટન સ્થાનિક રેસ્ટોરન્ટો અને બારને આર્થિક મદદ માટે બહારની જગ્યાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે

બ્રેમ્પટન, ઓન્ટારિયો (15 જૂન 2020) – ગત સપ્તાહમાં બ્રેમ્પટન સિટી કાઉન્સિલે સ્થાનિક રેસ્ટોરન્ટો અને બાર છેવટે જ્યારે પ્રોવિન્સ મંજૂરી આપે ત્યારે ફરી ખુલ્લા મુકવાની તૈયારી કરી રહ્યા છે, ત્યારે તેમને મદદરૂપ થવા માટેના પ્લાનને મંજૂરી આપી હતી.

રિજનલ કાઉન્સિલર પેટ ફોર્ટિનીએ કાઉન્સિલ સમક્ષ પ્રસ્તાવ રજૂ કર્યો જેમાં વિનંતી કરવામાં આવી છે કે સ્થાનિક રેસ્ટોરન્ટો અને બારને બહારની જગ્યાઓ વિસ્તારિત કરવાની મંજૂરી આપવામાં આવે જેથી વ્યવસાય ફરી બેઠો કરવામાં પ્રોત્સાહન મળે જે તેઓએ જેક ઍસ્ટર્સ બાર એન્ડ ગ્રિલ (Jack Astor's Bar and Grill) તેમજ ઓસ્કાર્સ રોડહાઉસ બાર એન્ડ ગ્રીલ (Oscar's Roadhouse Bar and Grill) જેવી સ્થાનિક રેસ્ટોરન્ટો સાથે વાત કરીને કર્યો હતો. આ દરખાસ્તને કાઉન્સિલ દ્વારા સર્વાનુમતે પસાર કરવામાં આવી હતી.

પ્રોવિન્સ દ્વારા આઉટડોર ડાઈન-ઇન સર્વિસિસ પુનઃ ખોલવાની પરવાનગી પ્રાપ્ત થતા જ બ્રેમ્પટન ખાતેના રેસ્ટોરન્ટો અને બાર પોતાના પાશિયો ફુટપાથ પર તેમજ પાર્કિંગના ક્ષેત્રમાં વિસ્તારી શકશે જેથી બેસવાની આઉટડોર જગ્યા વધારી શકાય. આ સમયે ઓન્ટારિયો સરકારે રેસ્ટોરન્ટો અને બારને તેમજ રિજન ઓફ પીલ ખાતેની અન્ય સંસ્થાઓ ખોલવાની મંજૂરી આપી નથી.

2020 ના વર્ષ માટે સ્થાનિક રેસ્ટોરન્ટો અને નાના વ્યવસાયોને ફરી બેઠા કરવામાં મદદરૂપ થવાના આશયથી આઉટડોર પેશિયો અને ફુટપાથની પરમીટ ફી પણ જતી કરવામાં આવશે.

ધીમે ધીમે સુરક્ષિત રીતે જ્યારે સિટીને ફરીથી ખુલ્લુ મુકવાના આયોજન થઈ રહ્યા છે ત્યારે કાઉન્સિલ અને કર્મચારીગણ રેસ્ટોરન્ટો અને વ્યવસાયો સાથે નજીકથી કાર્ય કરી એવી રીતે શોધશે જેથી જાહેર જનતાના આરોગ્યની માર્ગદર્શિકા અને ભૌતિક અંતર જાળવવાના નિયમોને વળગી રહીને ઓછું જોખમ ધરાવતી કામગીરીઓ વધારી શકાય.

ઈકોનોમિક રિકવરી સ્ટ્રેટજી

બ્રેમ્પટનનાં અર્થતંત્રમાં સ્થાનિક વ્યવસાયોની નિર્ણાયક ભૂમિકા છે. ગત માસમાં બ્રેમ્પટન સિટી કાઉન્સિલે બ્રેમ્પટનના [ઈકોનોમિક રિકવરી સ્ટ્રેટજી](#) (અર્થતંત્રને ફરી બેઠું કરવાના વ્યુહ)ને મંજૂરી આપી હતી જેમાં નાના વ્યવસાયો, રેસ્ટોરન્ટો અને પ્રવાસનને મદદરૂપ થતા પગલાંનો સમાવેશ થાય છે. એના ભાગરૂપે સિટીએ તેમનું [“સપોર્ટ લોકલ” અભિયાન](#) શરૂ કર્યું છે

જેમાં રહેવાસીઓને COVID-19 તેમજ ત્યાર બાદ પણ લોકલ વસ્તુઓ શોધવા, પસંદ કરવા અને ખરીદવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

અવતરણો

"તેઓ સુરક્ષિત રીતે ફરી ખોલવા માટે જરૂરી વ્યવસ્થા કરી રહ્યા છે ત્યારે ઉપયોગી ઉકેલો પર અમે આપણા સ્થાનિક વ્યવસાયો સાથે મળીને કાર્ય કરવા પ્રતિબદ્ધ છીએ. મારો પરિવાર આપણી સ્થાનિક રેસ્ટોરન્ટોનો લાભ દરેક ટેકઆઉટ વેનસડે પર લઈ રહ્યો છે અને હું પોતે પણ બહાર ડાઈન કરવાની આશા સેવી રહ્યો છું અને તેમ કરવાની મંજૂરી મળે તેમજ તેમ કરવું સુરક્ષિત હશે ત્યારે લોકલને ટેકો આપો ચાલુ રાખીશું."

- પૅટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રૅમ્પટન

"આપણી સ્થાનિક રેસ્ટોરન્ટોને મોઢેમોઢ અમે કહેતા સાંભળ્યા છે કે COVID-19 ને કારણે તેઓને કેટલો મોટો ફટકો પડ્યો છે. ધીમે ધીમે આપણે જ્યારે પુનઃ બંધ ખુલ્લુ મુકવાનું કાર્ય ચાલુ કર્યું છે ત્યારે અમે આપણા સ્થાનિક વ્યવસાયોને સંપૂર્ણ અને સુરક્ષિત રીતે પુનઃઉત્થાન તરફ વાળવા માટે તમામ રીતે મદદરૂપ થઈશું."

ગૂરપ્રીત ધિલ્લોન, રીજનલ કાઉન્સિલર, વોર્ડ 9 & 10; પ્રમુખ, ઈકોનોમિક ડેવેલપમેન્ટ એન્ડ કલ્ચર: સીટી ઓફ બ્રૅમ્પટન.

"અમારે માટે બ્રૅમ્પટનમાં નાના વ્યવસાયોના હિત મોખરે છે. વ્યવસાયોને હવે તેમની બહારની જગ્યાઓ પર આ ફેરફારોનું આયોજન કરવાની મંજૂરી આપવાથી જ્યારે આપણને પ્રોવિન્સ અને પીલ પબ્લિક હેલ્થ તરફથી લીલીઝંડી મળશે ત્યારે તેઓ શુભારંભ કરવા તૈયાર હોવાનું સુનિશ્ચિત કરશે."

- પૉલ વિસેન્ટ, રીજનલ કાઉન્સિલર, વોર્ડ 1 & 5; ઉપ પ્રમુખ, ઈકોનોમિક ડેવેલપમેન્ટ એન્ડ કલ્ચર: સીટી ઓફ બ્રૅમ્પટન.

"અમારા કર્મચારીગણ અને કાઉન્સિલે આપણા સ્થાનિક વ્યવસાયોની તેમજ હિસ્સાધારકોની જરૂરિયાતો જાણી લીધી છે અને અમે શક્ય હોય ત્યાં તે બાબતે પગલાં લઈ રહ્યા છીએ જેથી તેમની પુનઃશરૂઆત વખતે તેમને મદદરૂપ થઈ શકાય. સિટી તરફ અમારી ભૂમિકા આપણો સમાજ સહાયારી રીતે પુનઃ બેઠો થાય અને તેમની સુરક્ષા વિષયક છે અને હું જાણું છું કે બહારની જગ્યાઓનો ઉપયોગ કરવાથી તે જ કરવામાં સહાયતા મળશે."

- ડેવિડ બારિક, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (David Barrick, Chief Administrative Officer), સિટી ઓફ બ્રૅમ્પટન

"ઓન્ટારિયો રેસ્ટોરન્ટ અને મોટેલ અસોસિએશન સીટી ઓફ બ્રૅમ્પટનને આઉટડોર પેશ્યો ખોલવા અને આ જગ્યાઓમાં વિસ્તાર કરવાના આ પ્રસ્તાવને વધાવી લેશે. રેસ્ટોરન્ટોને નુકસાન વેઠવું પડ્યું છે અને આનાથી પોતે રજૂ કરતા સ્વાદિષ્ટ ખાદ્ય પદાર્થો માણવા માટે ગ્રાહકો તેમની સંસ્થાઓની મુલાકાત લેવાનું શરૂ કરશે જેથી ધીમે ધીમે તેમનો વિશ્વાસ સંપાદિત કરવામાં પ્રગતિ સાધી શકાશે."

- ટોની એલેનિસ, પ્રમુખ અને ચીફ એગ્ઝિક્યુટિવ ઓફિસર, ઓન્ટારિયો રેસ્ટોરન્ટ હોટેલ એન્ડ મોટેલ અસોસિએશન (ORHMA)

“ડાઉનટાઉન બ્રમ્પટન ખાતે લાંબા સમયથી ચાલતા અને મુખ્ય વ્યવસાય તરીકે અમે સમાજના પણ આભારી છીએ અને સિટીએ અમને તે આવા મુશ્કેલ સમયમાં તે દર્શાવ્યું છે. અમને જેવી ફરીથી ખોલવાની મંજૂરી મળે ત્યારે સિટી દ્વારા ઘોષીત આ ફેરફારોથી અમને અમારા મૂલ્યવાન અને ઘણા વખતથી અમે જેમને યાદ કરતા હતાં એવા ગ્રાહકોને સંભવ હોય એટલી સુરક્ષિત રીતે પાછા લાવી શકીશું. તેમ કરવાનું સલામતીભર્યું હોય ત્યારે હું બધાંને આમારા પેશ્યો પર જોવા ઉત્સુક છું.”

સબેના કુલ્ટર, માલિક, ફેનઝોરેલીઝ રેસ્ટોરન્ટ એન્ડ વાઈન બાર (Fanzorelli's Restaurant & Wine Bar)

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca